

**B.A. Semester - 6 (CBCS) Examination
May/June-2021 (NEW COURSE)
PHI P22 YogaDarshan (Core -22)**

Time: 1:30 Hours**Marks: 42****Instructions:**

1. Figures to the right indicate marks.
2. There are five questions in the question paper.
3. Answer any three of the following questions.

-
- | | |
|--|------|
| પ્રશ્ન-૧ અષ્ટાંગ યોગ સમજાવો. | (૧૪) |
| પ્રશ્ન-૨ યોગ અનુસાર સમાધિના પ્રકાર સમજાવો. | (૧૪) |
| પ્રશ્ન-૩ યોગદર્શનની જ્ઞાન મીમાંસા સમજાવો. | (૧૪) |
| પ્રશ્ન-૪ યોગમાં ઈશ્વરનું સ્થાન સમજાવો. | (૧૪) |
| પ્રશ્ન-૫ ટુંકનોંધ લખો. (કોઈ પણ બે) | (૧૪) |
1. ચિત્તવૃત્તિના પ્રકારો સમજાવો
 2. ચિત્તવૃત્તિના ઉપાયો સમજાવો.
 3. પંચ કલેશ સમજાવો.
 4. યોગની વર્તમાનમાં પ્રસ્તુતતા.

English Version

- | | |
|---|------|
| Que-1 Explain the eight path of Yoga. | (14) |
| Que-2 Explain the types of Samadhi according to yoga. | (14) |
| Que-3 Explain the epistemology of yoga darshan. | (14) |
| Que-4 Explain the place of God in yoga | (14) |
| Que-5 Write short notes. (any two) | (14) |
1. Explain the types of Chittavritti.
 2. Explain The Remedy of Chittavritti.
 3. Explain Five Afflictions.
 4. Importance of Yoga in Present.
